



25th January , 2025

Corporate Relationship Department
BSE Ltd.
P.J. Towers,
Dalal Street
Mumbai-400 001

Listing Department
National Stock Exchange of India Ltd.
Exchange Plaza,
Bandra-Kurla Complex,
Bandra (East)
Mumbai-400 051

Scrip Code:502180

Symbol: SHREDIGCEM

Dear Sir/Madam,

Sub: Intimation to Stock Exchanges regarding Newspaper publication of Standalone and Consolidated Un-audited Financial Results for the quarter and nine months ended 31st December, 2024.

Pursuant to the provisions of Regulation 33 and other applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI LODR'), the Board of Directors of Shree Digvijay Cement Company Limited at its meeting held on Friday, 24th January, 2025 considered and approved the un-audited standalone and consolidated financial results of the Company for the quarter and nine months ended 31st December, 2024.

Further, pursuant to provisions of Regulation 47 of SEBI LODR, the extract of the Un-audited standalone and consolidated results of the Company for quarter and nine months ended 31st December, 2024 have been published by the Company in Financial Express- all India edition in English and Financial Express -Gujarati.

Copies of the same are attached for your information and record.

Furthermore, in terms of provisions of Regulation 46 of SEBI LODR, the aforesaid results are also uploaded on the website of the Company i.e. www.digvijaycement.com

Yours truly,
For Shree Digvijay Cement Company Limited

Suresh Meher
VP(Legal) & Company Secretary

Encl. : As above

Shree Digvijay Cement Company Limited

Registered Office: Digvijaygram 361140 (Gujarat)
Phone : 0288-2344272-75 Fax : 0288-2344092, Email : investors.sdcl@digvijaycement.com
CIN : L26940GJ1944PLC000749, Website : www.digvijaycement.com

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2024

(Rs. in Lakhs)

Table with 12 columns: Particulars, Standalone (Quarter ended, Nine Months ended, Year Ended), Consolidated (Quarter ended, Nine Months ended, Year Ended). Rows include Total Income from Operations, Profit for the period, Total Comprehensive Income, etc.

Note: The above is an extract of the detailed format of standalone and consolidated Statement of financial results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.



For Shree Digvijay Cement Company Limited
Sd/-
Krishna kumar Ramanujan
CEO & Managing Director
(DIN: 10412896)

Place: Digvijaygram
Date: January 24, 2025

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications.

RELIGARE ENTERPRISES LIMITED

Regd. Off: 1407, 14th Floor, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi - 110019
CIN: L24990DL1984PLC426935
Website: www.religare.com

PUBLIC NOTICE

This Public Notice is being issued by Religare Enterprises Limited ("REL" or the Company), Religare Finvest Limited ("RFL") and Religare Housing Development Finance Corporation Limited ("RHDFCL"), pursuant to Paragraph 23 of Master Direction, 2023 (the "MD") issued by SEBI on September 28, 2023, regarding the 42.3 of Master Direction - Reserve Bank of India (Non-Banking Financial Company - Scale Based Regulation) Directions, 2023 ("SBR Directions") and Paragraph 27 of Master Direction - Non-Banking Financial Company - Housing Finance Company (Reserve Bank) Directions, 2021 ("HFC Directions") respectively, as amended from time to time.

RELIGARE ENTERPRISES LIMITED is a public limited company, having its registered office at 1407, 14th Floor, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi - 110019. The Company is listed on National Stock Exchange of India Limited and BSE Limited. The Company is registered with the Reserve Bank of India (RBI) as a Non-deposit taking, Systemically Important, Core Investment Company (Certificate No. N-14-03222) and classified as a Middle Layer Non-Banking Financial Company ("NBFC") under the SBR Directions.

RELIGARE FINVEST LIMITED, a wholly-owned subsidiary of REL, is a public limited company, having its registered office at 1407, 14th Floor, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi - 110019. The Company is registered with the Reserve Bank of India (RBI) as a Non-deposit taking Housing Finance Company (Certificate No. 10.10088.10) and classified as a Middle Layer NBFC under the SBR Directions.

RELIGARE HOUSING DEVELOPMENT FINANCE CORPORATION LIMITED, a subsidiary of REL, is a public limited company, having its registered office at 1407, 14th Floor, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi - 110019. The Company is registered with the Reserve Bank of India as a Non-deposit taking Housing Finance Company (Certificate No. 10.10088.10) and classified as a Middle Layer NBFC under the SBR Directions.

Proposed Acquisition: An Open Offer was made by the Acquirers under Regulations 3(1) and (4) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended ("SEBI (SAST) Regulations") to acquire equity shares representing up to 26.05% of the expanded voting capital of REL from the public shareholders of REL ("Open Offer") pursuant to a public announcement dated September 25, 2023, issued by JFM Finance Limited, manager to the Open Offer ("Public Announcement").

Reasons for Proposed Acquisition: As per the Open Offer Documents, the Acquirers intend to take control of the Company once the Open Offer is concluded in accordance with the provisions of SEBI (SAST) Regulations; review the management structure of the Company and its subsidiaries; and, subject to compliance with the provisions of SEBI (SAST) Regulations, reserve the right to acquire the Target Company and its subsidiaries in such a manner as the management structure as determined by the Board of Directors of the Company to be effected in accordance with the applicable legal requirements and after obtaining necessary regulatory approvals, if any.

Statutory/Regulatory Approvals in relation to the Proposed Acquisition: Insurance Regulatory and Development Authority of India (IRDAI), in respect of application made by Care Health Insurance Limited, REL's health insurance subsidiary, advised that they have no objection for the proposed open offer pertaining to the shares of REL subject to the insurer, promoter(s), transferor and transferee obtaining all the necessary approvals from other statutory/regulatory/judicial authorities. In respect of application of REL's insurance web aggregator subsidiary, MIC Insurance Web Aggregator Private Limited, IRDAI has informed that the provisions regarding transfer of shares of web aggregator under section 8(i) of IRDAI (Insurance Web Aggregator) Regulations, 2017 are not attracted.

Securities and Exchange Board of India ("SEBI") has granted approval for change of control of subsidiaries of REL which are registered/regulated by SEBI. Reserve Bank of India ("RBI"), vide letter dated December 09, 2024 ("RBI Conditional Approval Letter") granted approval for change of shareholding subject to the conditions in paragraphs 3, 4 and 5 of such letter as extracted below:

- 3. The approval is subject to the following conditions: i. The acquirers are advised to consolidate the NBFCs in the resulting structure/group (both Burman and Religare group) at the earliest and not later than March 31, 2026. In this regard, the acquirers are advised to submit a concrete and specific consolidation plan, with specific timelines, duly supported by Board Resolutions from each of the NBFCs within the groups, within 90 days from the date of this communication. ii. Any adverse action against the UBODs (Ultimate Beneficial Owners) of the acquirers by Law Enforcement Agencies or any order passed by any regulator/court, impacting the entities/individuals of the acquisition itself shall be intimated to the Reserve Bank immediately. iii. Subsequent to issue of this letter, if any adverse information or developments or discrepancies in information submitted, in respect of acquirers or their promoters/promoter group, persons acting in concert, etc., comes to the knowledge of Reserve Bank, it reserves the right to impose additional conditions or take any other measure, including but not limited to, withdrawal of the approval itself, as deemed fit. iv. The approval is subject to compliance to Master Direction - Reserve Bank of India (Non-Banking Financial Company - Scale Based Regulation) Direction, 2023, and other statutes, regulations and guidelines as applicable. v. The approval is not prejudicial to the decision taken by any court/judicial authority/regulator/legal body in the matter. vi. REL shall inform Reserve Bank about the date on which the acquirers have acquired 26% or more of the paid-up share capital of the NBFC. vii. REL shall adhere to the requirement of at least 30 days' prior public notice as required in terms of para 29 of the Master Direction - Core Investment Companies (Reserve Bank) Directions, 2016 (MD-CIC) dated August 25, 2016. viii. REL shall ensure compliance with instructions as specified in para 6 of the MD/CIC dated August 25, 2016. ix. If the acquirers fail to acquire the proposed shareholding within a period of one year from the date of this letter, this approval shall stand cancelled. After execution of the proposed change in shareholding, if the shareholding of the acquirers in the NBFC is 26% or more.

This condition specified in paragraph 3(i) of the RBI Conditional Approval Letter is hereinafter referred to as the "Consolidation Condition". The concrete and specific consolidation plan envisaged therein is hereinafter referred to as the "Consolidation Plan". As per the aforesaid approval letter of the RBI, the Consolidation Plan is required to be approved by the Boards of Directors in Burman and REL Group and submitted to the RBI within 90 days from December 09, 2024. This condition has not been detailed in the LOF. The RBI has permitted the Acquirers to take over control of the Target Company subject to compliance with (among others) the Consolidation Condition. As of today, REL is yet to receive any Consolidation Plan from the Acquirers for consideration by the Board of Directors of REL / NBFCs in Religare Group. The Consolidation Plan and its impact on REL, RFL and RHDFCL and public shareholders of REL is currently unknown. The Target Company has appointed the RBI and the SEBI of the aforesaid and has sought guidance from them on sequencing of the RBI mandated conditions and the Open Offer. The Target Company is yet to receive guidance from RBI and SEBI on the above. In case the conditions mandated in the RBI Conditional Approval Letter are not met, possibility of adverse orders being passed by RBI / Regulatory Authorities against the Open Offer / Acquirers cannot be ruled out.

Any clarifications and/or objections in this regard may be sent to the Company/RFL/RHDFCL within 30 days from the date of this notice addressed to the Compliance and Secretarial Department, at the registered office or e-mail at investorservices@religare.com. Sd/- RELIGARE ENTERPRISES LIMITED Sd/- RELIGARE FINVEST LIMITED Sd/- RELIGARE HOUSING DEVELOPMENT FINANCE CORPORATION LIMITED

STEEL EXCHANGE INDIA LIMITED

Regd. Office : Door No - 165/K/60, Abhis Hiranyaa, 1st Floor, Kavuri Hills, Hyderabad-500081
Phone : +91-40-2340 3725, Fax : +91-40-2341 3267
Web : www.sell.co.in E-mail : info@sell.co.in

Extracts of Unaudited Financial Results for the Quarter and Nine Months Ended 31.12.2024

Table with 7 columns: Particulars, Quarter ended (31.12.2024, 30.09.2024, 31.12.2023), Nine months ended (31.12.2024, 31.12.2023), Year ended (31.03.2024, 31.03.2023). Rows include Total Income from Operations, Net Profit/(Loss), Total Comprehensive Income, etc.

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites www.sebiindia.com, www.bseindia.com and on Company's website www.sell.co.in. The same can be accessed by scanning the given QR Code.



By order of the Board for Steel Exchange India Limited
Sd/-
B. Satish Kumar
Managing Director
DIN: 00163978

Place : Hyderabad
Date : 24/01/2025

TATA POWER

(Corporate Contracts Department)
The Tata Power Company Limited, 27 Floor, Sahar Receiving Station
Sahar Airport Road, Andheri East, Mumbai-400059
(Board Line: 022-47173188) CIN: L2820MH1919PLC000567

NOTICE INVITING TENDER (NIT)

The Tata Power Company Limited invites tenders from eligible vendors for the following tender packages (Two Part Bidding):
Outline Agreement for Supply of Desktops (Package Ref: CSC25A5055)
Outline Agreement for Supply of Desktops (Package Ref: CSC25A5056)
For detailed NIT, please visit Tender section on website https://www.tatapower.com. Interested and eligible bidders to submit Tender Fee, Authorization Letter and Bid Documents complete in all respect, for the respective tender package, before Monday, 17th February, 15:00 Hrs. Future corrigendum's (if any), to the above tenders will be published on Tender section on website https://www.tatapower.com only.

SURYA INDUSTRIAL DEVELOPMENTS LIMITED

CIN:L65521WB1980PLC033204
Regd. Office : 141/B Ezra Street Kolkata 700011
Email: sj22020@gmail.com, http://suryaindustrialdevelopments.in/en/

Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter ended December 31, 2024

Table with 7 columns: S.No., Particulars, Quarter ended (31 Dec 2024, 30 Sep 2024, 31 Dec 2023), Nine months ended (31 Dec 2024, 31 Dec 2023), Year ended (31 Mar 2024, 31 Mar 2023). Rows include Total Income from operations, Net Profit/(Loss), Total Comprehensive Income, etc.

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange and the listed entity www.suryaindustrialdevelopments.in.net. For and on behalf of the Board of Directors Sd/- Satya Narayan Suresh Director DIN: 00567139

Date: 24/01/2025
Place: Kolkata

VIMTA LABS LIMITED

CIN: L24110TG1990PLC11977
Registered Office: 142, BIA Phase II, Cherappally, Hyderabad - 500051, India
Tel: +91 4027264141; Fax: +91 4027263557
E-Mail: shares@vimta.com, Website: www.vimta.com

Statement of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2024

Table with 7 columns: S.No., Particulars, Quarter Ended (31 Dec 24, 30 Sep 24, 31 Dec 23), Nine Months Ended (31 Dec 24, 31 Dec 23), Year Ended (31 Mar 24, 31 Mar 23). Rows include Total Income from Operations, Net Profit/(Loss), Total Comprehensive Income, etc.

Note: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's Website (www.vimta.com) and on the websites of SEBI (www.sebiindia.com) and the National Stock Exchange of India Limited (www.nseindia.com). The same can be accessed by scanning the QR Code provided below. 2. The above unaudited consolidated financial results for the quarter and nine months ended December 31, 2024 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board in its meeting held on January 24, 2025. 3. Figures of the previous periods have been regrouped/reclassified wherever considered necessary.

For and on behalf of the Board of Directors of Vimta Labs Limited Sd/- Harita Vasireddi Managing Director DIN: 00242512

Place : Hyderabad, India
Date : January 24, 2025

THE LATEST TRENDS IN BUSINESS THE LATEST TRENDS IN TRENDS

એચપીસીએલના સ્ટોકમાં લગભગ ૫%નો ઉછાળો

ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૩ ગણાથી વધુ થયો

પીટીઆઈ નવી દિલ્લી, તા. ૨૪ યુકવારે | સંદુરસ્તાન પ્રોટોલાઇમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના શેરમાં લગભગ ૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. કારણ કે કંપનીએ માર્કેટિંગ માર્ચિનમાં વધારો થતાં તેના ટ્રિસેમ્બર ત્રિમાસિકના ચોખ્ખા નફામાં ત્રણ ગણો વધુ વધારો નોંધાયો હતો. બીએસઈ પર શેર ૪.૯૧ ટકા ઉછાળીને રૂપિયા ૩૮૦ પર પહોંચી ગયો છે. એનએસઈ ખાતે તે ૪.૯૨ ટકા વધીને રૂ ૩૮૦.૯૫ પર પહોંચી ગયો હતો. કંપનીના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૪) માટે એકીકૃત ચોખ્ખો નફો રૂપિયા ૨,૫૪૩.૬૫ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂપિયા ૭૯૨.૮૪ કરોડ હતો.

વિગત	અલાયદા						સંયુક્ત											
	ત્રિમાસિક ગાળાના અંતે			નવા માસિકના અંતે			વર્ષના અંતે			ત્રિમાસિક ગાળાના અંતે			નવા માસિકના અંતે			વર્ષના અંતે		
	31-Dec-2024 (અન ઓફિસ)	30-Sep-2024 (અન ઓફિસ)	31-Dec-2023 (અન ઓફિસ)	31-Dec-2024 (અન ઓફિસ)	31-Dec-2023 (અન ઓફિસ)	31-Mar-2024 (અન ઓફિસ)	31-Dec-2024 (અન ઓફિસ)	30-Sep-2024 (અન ઓફિસ)	31-Dec-2023 (અન ઓફિસ)	31-Dec-2024 (અન ઓફિસ)	31-Dec-2023 (અન ઓફિસ)	31-Mar-2024 (અન ઓફિસ)	31-Dec-2024 (અન ઓફિસ)	31-Dec-2023 (અન ઓફિસ)	31-Mar-2024 (અન ઓફિસ)			
કામકામમાં કુલ આવક (ચોખ્ખો)	18,833.41	14,601.14	19,324.81	51,332.04	57,344.53	80,097.34	18,833.41	14,602.33	19,336.72	51,336.51	57,381.05	80,144.61						
ગાળાના સોખ્ખો નફો (તોલો) (વેસ પુર્વે)	(647.02)	74.43	4,199.06	929.89	7,525.49	11,820.67	(647.88)	74.30	4,199.95	928.93	7,528.28	11,824.21						
ગાળાના નફો(તોલો)	(483.06)	39.61	3,139.54	683.80	5,602.78	8,775.71		39.48	3,140.43	682.65	5,604.87	8,778.36						
ગાળાની કુલ સંયુક્ત આવક ગાળાનો નફો (વેસ પછી) અને અન્ય અવધિઓ (વેસ પછી) સહીત	5.38	(58.01)	(36.63)	(77.99)	(96.42)	(12.14)	5.38	(58.01)	(36.63)	(77.99)	(96.42)	(12.14)						
છાંદવટી શેર મુદ્દી	14,781.50	14,740.75	14,677.10	14,781.50	14,677.10	14,740.75	14,781.50	14,740.75	14,677.10	14,781.50	14,677.10	14,740.75						
અન્ય છાંદવટી પુર્ણ મુલ્યાંકિત અનામતો વિચારણની અવધિઓ (વેસ પછી) (વેસ પછી) (વેસ પછી)						23,379.91						23,379.91						
મૂળ શેર ટીકા કમાણી (ફા.મં.)	(0.33)	0.03	2.15	0.46	3.85	6.01	(0.33)	0.03	2.15	0.46	3.85	6.01						
વટાટી ટીકા કમાણી (ફા.મં.)	(0.33)	0.03	2.15	0.46	3.83	6.01	(0.33)	0.03	2.15	0.46	3.83	6.01						

નોંધ: સોની (સિટીરીંગ અને અન્ય ડિસક્રીપ્શન સીક્યુરાઇઝેશન) નિવેદનમાં, રૂપિયા ના નિવેદન ૩૩ કરોડ રોકેટ એક્સચેન્જનાં અંદાજ કરેલા અલાયદા અને સંયુક્ત નાણાકીય પરિણામોના નિવેદનોની વિગતવાર માહિતીનો સાર ઇન્કુર મુજબ છે. અલાયદા અને સંયુક્ત નાણાકીય પરિણામોના નિવેદનોની વિગતવાર માહિતી સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com, www.nseindia.com અને કંપનીની વેબસાઇટ www.digvijaycement.com ઉપર ઉપલબ્ધ છે અને નીચે આપેલ સ્ક્રીન શીટ્સમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે.

સ્થાન: દિગ્વિજયગ્રામ તારીખ: ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫

સાથિયો લાઇફ આઇસીઆઇ		સાથિયો લાઇફ આઇસીઆઇ	
વેબસાઇટ	સંપર્ક માહિતી	વેબસાઇટ	સંપર્ક માહિતી
www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨

ક્રમ	દેવદાસ/સાથિયો લાઇફ આઇસીઆઇ	વેબસાઇટ	સંપર્ક માહિતી
૧	સાથિયો લાઇફ આઇસીઆઇ	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨
૨	સાથિયો લાઇફ આઇસીઆઇ	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨
૩	સાથિયો લાઇફ આઇસીઆઇ	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨

Sustainability. Growth. Profitability.

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTHS ENDED DECEMBER 31, 2024

Sr. No.	Particulars	Quarter ended		Quarter ended		Nine Months ended		Nine Months ended		Year ended
		31-12-2024	30-09-2024	31-12-2023	31-12-2024	31-12-2023	31-12-2024	31-12-2023	31-03-2024	
1	Total Revenue from Operations	1,856.48	1,686.20	1,400.74	5,123.76	4,121.89	5,703.70			
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional)	625.80	620.64	400.99	1,844.20	1,125.15	1,656.90			
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional)	625.80	620.64	400.99	1,844.20	1,125.15	1,656.90			
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional)	467.83	461.49	297.87	1,375.76	821.82	1,191.14			
5	Total Comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)	468.43	459.33	300.57	1,373.65	837.71	1,207.37			
6	Equity Share capital	160.97	160.97	160.97	160.97	160.97	160.97			
7	Other Equity	9,301.95	8,897.91	7,623.04	9,301.95	7,623.04	9,301.95			
8	Earning per share (of ₹2/- each) (not annualized)									
	1. Basic	5.82	5.71	3.70	17.07	10.21	14.80			
	2. Diluted	5.82	5.71	3.70	17.07	10.21	14.80			

Notes:

- The Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on January 24, 2025. The Auditors of the Company have carried out limited review of the Unaudited Financial Results for the Quarter and nine month ended December 31 2024.
- The above is an extract of the detailed form of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full form of the Quarterly Financial Results are available on the websites (www.bseindia.com), (www.nseindia.com) and Company's website (www.supriyalife.com)

For Supriya Lifescience Limited
Sd/-
Dr. Satish Waman Gajjar
Chairman and Whole time director
Date: Mumbai
Place: January 24, 2025

ક્રમ	દેવદાસ/સાથિયો લાઇફ આઇસીઆઇ	વેબસાઇટ	સંપર્ક માહિતી
૧	સાથિયો લાઇફ આઇસીઆઇ	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨
૨	સાથિયો લાઇફ આઇસીઆઇ	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨
૩	સાથિયો લાઇફ આઇસીઆઇ	www.supriyalife.com	૧૯૨૮-૨૩૪૪૨૨-૫૫૬૬૬૬ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨ ૨૨૨૨-૨૩૪૪૨૨૨૨